



		ત્યારબાદ પગાર ધોરણ ૫૨૦૦- ૨૦૨૦૦ ગ્રેડ પે-૧૯૦૦									
--	--	--	--	--	--	--	--	--	--	--	--

નોંધ:-

- (૧) જા.નં.૦૧/૨૦૧૨-૧૩ અન્વયે ૧. જુનીયર કલાર્ક, ૨. જુનીયર કલાર્ક(હિસાબી) સંવર્ગની કુલ ખાલી જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે ૧૦% જગ્યાઓ અને શા.ખો.ખાં. માટે ૩% જગ્યાઓ અનામત છે.
  - (૨) અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના ઉમેદવારો માટે જ અનામત છે.
  - (૩) મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા તે જ કેટેગરીના લાયક પુરૂષ ઉમેદવારથી ભરવામાં આવશે.
  - (૪) માજી સૈનિક તથા વિકલાંગની જગ્યા જે તે કેટેગરીની જગ્યા સામે સરભર કરવામાં આવશે. જો માજી સૈનિક કેટેગરીમાં લાયક ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યાઓ જે તે કેટેગરીના ઉમેદવારોથી ભરવામાં આવશે.
  - (૫) ઉક્ત જગ્યા માટેના પગાર ધોરણ/ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નીચેની વિગતે છે, જે નિયત લાયકાતો ધરાવતા ઉમેદવારે ઉક્ત જગ્યા માટે એક જ અરજી કરવાની રહેશે.
૨. પગાર ધોરણ:- સમિતિ ધ્વારા પસંદગી પામેલ ઉમેદવારને આ જગ્યા ઉપર નિમણુંક થયેથી, નાણાં વિભાગના તા. ૧૬-૨-૨૦૦૬ના તથા તા. ૨૯-૪-૨૦૧૦ ના ઠરાવ ક્રમાંક: ખરચ-૨૦૦૨-૫૭-ઝેડ-૧, અન્વયે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ માટે જે તે જગ્યા માટે નિયત થયેલ ફીક્સ પગાર મળશે અને પસંદગી પામેલ ઉમેદવારને નિમણુંક સત્તાધિકારી ધ્વારા સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૪-૬-૨૦૦૯ ના ઠરાવ ક્રમાંક: સીઆરઆર-૧૧૨૦૦૮- ૪૩૩૭૧૭ – ગ-પ, માં દર્શાવેલ બોલીઓ અને શરતોને આધીન આ જગ્યા ઉપર નિમણુંક આપવામાં આવશે તેમજ પાંચ વર્ષના અંતે તેમની સેવાઓ નિમણુંક સત્તાધિકારીને સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે જગ્યા માટે મળવાપાત્ર પગાર ધોરણમાં નિયમિત નિમણુંક મેળવવાને પાત્ર થશે.
૩. રાષ્ટ્રીયતા:- ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
૪. (૧) વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગતો:-

જા. ક.	સંવર્ગ	વયમર્યાદા/ શૈક્ષણિક લાયકાત
૦૧/૨૦૧૨-૧૩	૧. જુનીયર કલાર્ક ૨. જુનીયર કલાર્ક (હિસાબી)	(ક) ઉમેદવાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો ન હોવો જોઈએ અને ૨૫ વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ નહીં. (ખ) ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨ H.S.C.E.) અથવા સરકારે માન્ય કરેલ સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. (ગ) ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે. નોંધ- જુનીયર કલાર્ક(હિસાબી)ની જગ્યા માટે ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨ H.S.C.E.) ગણિતશાસ્ત્રના એક વિષય સાથે પાસ કરેલી હોવી જોઈશે.

૪. (૨) વયમર્યાદામાં છૂટછાટ:- અનામત વર્ગના ઉમેદવારોને તથા મહિલા ઉમેદવારોને નીચે મુજબ નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર છે.
- (ક) મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સા.શૈ.પ. વર્ગના પુરૂષ ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં પાંચ (૫) વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
- (ખ) બિન અનામત વર્ગના મહિલા ઉમેદવારને પાંચ વર્ષની તથા તમામ અનામત વર્ગના મહિલા ઉમેદવારને દશ (૧૦) વર્ષની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
- (ગ) ૪૦% કે તેથી વધુ અપંગતા ધરાવતાં ઉમેદવારોને મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં દશ (૧૦) વર્ષની વધારાની છૂટછાટ મળશે.
- (ઘ) માજી સૈનિક ઉમેદવારો કે જેઓએ જલ, વાયુ અને સ્થલ આર્મ ફોર્સીસમાં ઓછામાં ઓછા છ માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખકાર્ડ ધરાવતા હોય તો મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ (૩) વર્ષ સુધીની છૂટછાટ મળશે.
- (ચ) સા.શૈ.પ. વર્ગના ઉમેદવારો નાણાંકીય વર્ષ ૨૦૧૧-૨૦૧૨ (તા.૧-૪-૨૦૧૧ થી તા. ૩૧-૩-૨૦૧૨) નું નોન કિમિલેયર સર્ટીફિકેટ સક્ષમ અધિકારીથી તા.૧-૪-૨૦૧૨ થી તા.૩૧-૧૨-૨૦૧૨ દરમ્યાન ઇસ્યુ કરેલ હોય તેવું ધરાવતા હશે તો જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટનો લાભ મળશે. અન્યથા તેઓ સામાન્ય કેટેગરીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી શકશે. જે કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ અને અનામતનો લાભ નહીં મળે.
- (છ) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો (સામાન્ય), ૧૯૯૮ મુજબ રાજ્ય સરકારમાં હાલ સેવા બજાવતા કર્મચારીઓ ઉમેદવારી નોંધાવશે તો તેવા ઉમેદવારોને કેટેગરી પ્રમાણે મળતી છૂટછાટ ઉપરાંત વધુ ત્રણ વર્ષની છૂટછાટ ઉપલી વયમર્યાદામાં મળશે.  
નોંધ:- તમામ કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર કોઇપણ સંજોગોમાં નિયત તારીખે ૪૫ વર્ષથી વધવી જોઇશે નહીં.

૫. કોમ્પ્યુટરની જાણકારી:-

ઉમેદવાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૧૩-૮-૨૦૦૮ ના સરકારી ઠરાવ નં. સીઆરઆર-૧૦-૨૦૦૭-૧૨૦૩૨૦-ગ-૫, થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર/ માર્કશીટ ધરાવતા હોવા જોઇશે. અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઇપણ ડિપ્લોમા/ ડીગ્રી કે સર્ટીફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઇશે. આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. પરંતુ આવા ઉમેદવારોએ નિમણુંક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝીક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પહેલા અચૂક રજૂ

કરવાનું રહેશે. અન્યથા નિમણૂક મેળવવાને પાત્ર થશે નહીં તેમજ નિમણૂક સત્તાધિકારી આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ કરશે.

૬. શૈક્ષણિક લાયકાત/ વયમર્યાદા/ વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ (cut off date) :-

જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોના કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને નોન ક્રીમીલેયર સર્ટી. અને અન્ય જરૂરી લાયકાત માટે તા.૩૧-૧૨-૨૦૧૨ ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.

૭. અરજી કરવાની રીત:- આ જાહેરાતના સંદર્ભમાં સમિતિ ધ્વારા NIC ની વેબસાઇટ મારફત ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તારીખ:૧૬-૧૨-૨૦૧૨ થી તા.૩૧-૧૨-૨૦૧૨ (સમય રાત્રિના ૧૧-૫૯ કલાક સુધી) દરમિયાન વેબસાઇટ <http://ojas.guj.nic.in> પર અરજીપત્રક ભરી શકશે. ઉમેદવારે

(૧) સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટમાં વેબસાઇટ <http://ojas.guj.nic.in> પર જવું.

હવે (૨) “Apply On line” Click કરવું.

(૩) “Junior Clerk” પર click કરવાથી જગ્યાની વિગતો મળશે.

(૪) તેની બાજુમાં “Apply now” પર click કરવાથી Application Format ખુલશે.

(૫) જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવી. (અહીં લાલ કુંદડી (\*) નિશાની હોય તેની વિગતો ફરજિયાત ભરવાની રહેશે.) અરજીમાં ઉમેદવારે મોબાઇલ નંબર દર્શાવવો જરૂરી છે.

(૬) Personal Details ભરાયા બાદ “Educational Details” ભરવા માટે “Educational Qualifications” પર click કરવું

(૭) ત્યારબાદ મેરીટ આધારે પસંદગીની જગ્યા પર નિમણૂક મેળવવા માટે જગ્યા પસંદગીના ક્રમ દર્શાવવા માટે “Preference for appointment” ઉપર click કરવું

(૮) તેની નીચે “Self declaration” ઉપરની શરતો સ્વીકારવા માટે “Yes” પર click કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.

(૯) ત્યારબાદ તેની નીચે એક કોડ સ્ક્રીન ઉપર દેખાશે, જેને Enter કર્યા બાદ “save” પર click કરવાથી તમારી અરજીનો online સ્વીકાર થશે.

(૧૦) અરજી કર્યા બાદ ઉમેદવારનો “Application Number” generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

(૧૧) હવે પેજના ઉપરના ભાગમાં “Upload Photograph પર click કરો અહીં તમારો Application Number type કરો અને તમારી Birth Date type કરો. ત્યારબાદ ok પર click કરવું.

અહીં Photo અને Signature Upload કરવાના છે. (Photo નું માપ ૫ સે.મી. ઉંચાઇ અને ૩.૬ સે.મી. પહોળાઇ અને Signature નું માપ ૨.૫ સે.મી. ઉંચાઇ અને ૭.૫ સે.મી. પહોળાઇ રાખવી.)

(photo અને signature upload કરવા સૌ પ્રથમ તમારો photo અને signature jpg format માં (15 kb) સાઇઝથી વધારે નહીં તે રીતે computer માં હોવા જોઇએ.) “browse” button પર click કરો.

હવે choose file ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં jpg format માં તમારો photo તોરે થયેલ છે, તે

ફાઇલને select કરો અને “open” button ને click કરો. હવે “browse” button ની બાજુમાં “upload” button પર click કરો. હવે બાજુમાં તમારો photo દેખાશે. હવે આ જ રીતે signature પણ upload કરવાની રહેશે.

(૧૨) હવે પેજના ઉપરના ભાગમાં “Confirm Application” પર click કરો અને “Application Number” તથા Birth Date type કર્યા બાદ ok પર click કરવાથી ત્રણ બટન (૧) ok (૨) show application preview અને (૩) confirm application દેખાશે. ઉમેદવારે show application preview પર click કરી પોતાની અરજી જોઈ લેવી. અરજીમાં સુધારો કરવાનો જણાય તો Edit Application ઉપર click કરીને સુધારો કરી લેવો. કન્ફર્મ કર્યા પહેલા કોઈપણ પ્રકારનો સુધારો અરજીમાં થઈ શકશે. પરંતુ અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો શક્ય બનશે નહીં: સંપૂર્ણ ચકાસણી બાદ જો અરજી સુધારવાની જરૂર ના જણાય તો જ Confirm Application પર click કરવું. તેથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થઈ જશે. અહીં “Confirmation number” generate થશે. જે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઈ, ઉમેદવારે સાચવવાનો રહેશે.

(૧૩) હવે Print Application પર click કરવું અહીં તમારો Confirmation number ટાઇપ કરવો અને Print પર click કરી અરજીની નકલ કાઢી સાચવી રાખવી.

(૧૪) જો અરજીમાં આપે મોબાઇલ નંબર દર્શાવેલ હશે તો અરજી confirm થયેથી તુરત જ આપને મોબાઇલ નંબર ઉપર તે અંગેનો SMS મળશે. અરજીમાં દર્શાવેલ આપના મોબાઇલ નંબર ઉપર બોર્ડ ધ્વારા આ જાહેરાત સંદર્ભે મળનાર વિવિધ SMS આપને માન્ય રહેશે.

૮. પરીક્ષા ફી:- બિન અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.

(૧) બિન અનામત વર્ગના પુરુષ/ મહિલા ઉમેદવારોએ પરીક્ષા સમયે પરીક્ષા ફી પેટે રૂ. ૧૦૦/- નો ભારતીય પોસ્ટલ ઓર્ડર સ્પર્ધાત્મક લેખિત કસોટીની તારીખ આખરી જાહેર થયા બાદ કોલલેટર online મેળવીને તુરત ખરીદેલ અને સચિવશ્રી, તાપી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, વ્યારાના નામનો કોર્સ ભારતીય પોસ્ટલ ઓર્ડર પરીક્ષા દિને કોલલેટરની સાથે લાવવાનો રહેશે અને પરીક્ષા હોલમાં ઇન્વીજીલેટરને સોંપવાનો રહેશે. (ફી રોકડમાં કે ડીમાન્ડ ડ્રાફ્ટમાં સ્વીકારવામાં આવશે નહીં) પરીક્ષા ફી અંગે ભારતીય પોસ્ટલ ઓર્ડર વગર આવેલ બિન અનામત વર્ગના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. (૨) મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો, શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો અને માજી સૈનિકોએ પરીક્ષા ફી ભરવાની નથી. (૩) અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત વર્ગની જગ્યા માટે અરજી કરે તો પણ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.

૯. પરીક્ષા પદ્ધતિ:-

અરજીપત્રકમાં ભરેલ સંપૂર્ણ વિગતોની પ્રાથમિક ચકાસણી બાદ નિયત લાયકાત અને નિયત વયમર્યાદામાં યોગ્ય ઠરેલ ઉમેદવારોને જુનીયર ક્લાર્કની જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે સમિતિ ધ્વારા પરીક્ષાની તારીખ આખરી કર્યા બાદ NIC ની વેબસાઇટ <http://ojas.guj.nic.in> મારફત online કોલલેટર ઇસ્યુ કરીને પરીક્ષાના તારીખ, સમય અને સ્થળની

જાણ કરવામાં આવશે. જે માટે સમિતિ ધ્વારા લાયક ઉમેદવારોને NIC ની નિયત વેબસાઇટ ઉપરથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર online download કરવા માટે ઓનલાઇન અરજીમાં દર્શાવેલ તેઓના મોબાઇલ નંબર ઉપર “SMS” મોકલીને અને અગ્રગણ્ય અખબારોમાં તેમજ વેબસાઇટ ઉપર ટૂંકી જાહેરાત આપીને જાણ કરવામાં આવશે. સદર સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ગુજરાત સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૭-૪-૨૦૧૨ના જાહેરનામા ક્રમાંક: કેપી/૧૧ ઓફ ૨૦૧૨/પીઆરઆર/ ૧૦૨૦૦૯/૧૯૭૬/ડી, થી ઠરાવ્યા મુજબ ફકત કુલ-૧ (એક) પ્રશ્નપત્ર નીચે મુજબ રહેશે. આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એક જ દિવસે અને સરખા સમયે નિયત પરીક્ષા કેન્દ્રો ખાતે સમિતિ ધ્વારા લેવામાં આવશે.

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા:-

પ્રશ્નપત્ર (હેતુલક્ષી), સમય: એક કલાક, કુલ ગુણ-૧૦૦

ઉક્ત પ્રશ્નપત્રમાં (૧) ગુજરાતી ભાષા અને વ્યાકરણ-૩૫ ગુણ (૨) ગણિત-૧૫ ગુણ (૩) અંગ્રેજી વ્યાકરણ-૧૫ ગુણ (૪) સામાન્ય જ્ઞાન-૩૫ ગુણના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.

(૧) સમિતિ ધ્વારા નિયત સમયમર્યાદામાં ઓનલાઇન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરીને લાયક ઉમેદવારોને આ સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉપસ્થિત રહેવા દેવામાં આવશે.

(૨) આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સામાન્ય જ્ઞાન આધારીત હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર ઓ.એમ.આર. (ઓપ્ટીકલ માર્કસ રીડીંગ) પદ્ધતિનું રહેશે.

(૩) સમિતિ ધ્વારા આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં ઉમેદવારે મેળવેલ ગુણ આધારે તમામ હાજર ઉમેદવારોનું મેરીટ લીસ્ટ તૈયાર કરીને જે તે કેટેગરીમાં ઉપલબ્ધ ખાલી જગ્યાના પ્રમાણમાં કેટેગરીવાર મેરીટ ક્રમાનુસાર જુનીયર ક્લાર્કની કેટેગરીવાર પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે, તેમજ કેટેગરીવાર મેરીટ આધારે તૈયાર થયેલ પસંદગી યાદીમાં પસંદગી પામેલ ઉમેદવારોને તેઓએ ઓનલાઇન અરજીમાં આપેલ જગ્યાના પ્રેક્ટરન્સો ધ્યાને લઈને પ્રેક્ટરન્સ કમ મેરીટ આધારે આ સંવર્ગની જે તે ખાલી જગ્યા ઉપર ફાળવણી કરીને વિગતવાર નિમણુંક માટે ભલામણ સમિતિ ધ્વારા નિયત શરતોને આધીન કરવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં અરજી સમયે જે તે જગ્યા માટે આપેલ પ્રેક્ટરન્સ કોઇપણ સંજોગોમાં બદલવા દેવાની રજૂઆત સમિતિ ધ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, તેમજ ઉમેદવારે આપેલ પ્રેક્ટરન્સ આખરી ગણવામાં આવશે જે ઉમેદવારને બંધનકર્તા રહેશે.

(૪) સમિતિ ધ્વારા સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ નિયત થયેથી ઉમેદવારોને ઓનલાઇન અરજીમાં દર્શાવેલ મોબાઇલ નંબર ઉપર “SMS” ધ્વારા તેમજ વેબસાઇટ ઉપર અને અગ્રગણ્ય અખબારોમાં જાહેરાત પ્રસિધ્ધ કરીને જાણ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોએ કોમ્પ્યુટર ઉપર NIC ની વેબસાઇટ ઉપરથી online કોલલેટર download કરીને મેળવી લેવાના રહેશે. જે માટે ઉમેદવારોએ online કોલલેટર મેળવવા કોમ્પ્યુટર ઉપર NIC ની વેબસાઇટની મુલાકાત સતત લેવાની રહેશે, અન્યથા સમિતિ જવાબદાર રહેશે નહીં.

૧૦. સામાન્ય શરતો:- (૧) બિન અનામત તથા અનામત વર્ગોના મહિલા ઉમેદવારોને તેમજ અનામત વર્ગોના પુરૂષ ઉમેદવારો, ૪૦ ટકા કે તેથી વધુ શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો અને

માજી સૈનિકોને મળવાપાત્ર બધી જ છૂટછાટ ગણતરીમાં લીધા બાદ વધુમાં વધુ ૪૫ વર્ષની ઉંમર સુધી જ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે. (૨) અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે નહીં. (૩) (અ) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ ઉચ્ચત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૬-૨-૧૯૯૬ ના ઠરાવથી નિયત થયેલ પરિશિષ્ટ-(ક) ના નમૂનામાં તા. ૩૧-૩-૨૦૧૨ના રોજ પૂરા થયેલ નાણાંકીય વર્ષ ૨૦૧૧-૨૦૧૨ (તા.૧-૪-૨૦૧૧ થી તા.૩૧-૩-૨૦૧૨) માટેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારીથી તા.૧-૪-૨૦૧૨ થી તા.૩૧-૧૨-૨૦૧૨ દરમ્યાન ઇસ્યુ કરાયેલ હોય તેવું અસલ પ્રમાણપત્ર માંગણી થયેથી બોર્ડને રૂબરૂ રજૂ કરવાનું રહેશે. અન્યથા ઉમેદવારી/ પસંદગી “રદ” કરવામાં આવશે.(બ) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણિત મહિલા ઉમેદવારે આવું નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર તેમના માતા-પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી રદ કરવામાં આવશે. (ક) જો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે ઉક્ત પેરા-૩ (અ) માં દર્શાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૧-૧૨નું નોન ક્રીમીલેયર સર્ટીફિકેટ અસલમાં માંગણી થયેથી રજૂ કરેલ નહીં હોય તો તેમજ બિન અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવેલ નહીં હોય તો તેઓની અરજી વિચારણામાં લેવાશે નહીં અને ઉમેદવારી/ પસંદગી “રદ” કરવામાં આવશે. (૪) ફી ભર્યા બાદ રીફંડ મળવાપાત્ર નથી તથા અરજી કર્યા બાદ પરત ખેંચી શકાશે નહીં. (૫) એક જાહેરાત માટે જો એકથી વધુ અરજી મળેલ હશે તો સૌથી છેલ્લી અરજી વિચારણામાં લેવામાં આવશે. (૬) સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર વિધવા મહિલા ઉમેદવાર માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. પરંતુ તેઓએ તે સમયે પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ.

તેવી જ રીતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૨૫.૨.૧૯૮૦, તા.૧.૮.૧૯૯૦ના અનુક્રમે સરકારી ઠરાવ નં. સીઆરઆર-૧૦૭૭-૨૬૬૦-ગ-૨, અને સરકારી ઠરાવ નં. સીઆરઆર-૧૧૮૮-૩૬૪૪-ગ-૨, થી નકકી થયા મુજબની રમતોમાં ભાગ લીધેલ હોય અને તે માટેનું નિયત સત્તાધિકારીએ આપેલ નિયત નમૂનામાંનું સર્ટીફિકેટ ધરાવતા ઉમેદવારને પસંદગીમાં અગ્રતા આપવા માટે તેમને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના ૫ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે. ઉપર જણાવેલ સરકારી ઠરાવો પંચાયત વિભાગની વેબ સાઇટ <http://panchayat.gujarat.gov.in> પર હોમપેજ પર અગત્યના ઠરાવો પર ક્લિક કરવાથી અન્ય ઠરાવોનું બોક્સ ખુલશે. અન્ય ઠરાવો પર ક્લિક કરવાથી આ ઠરાવો ઉપલબ્ધ થશે.

સમિતિની કચેરી માંગે ત્યારે તેના તમામ પુરાવાઓ અસલમાં સમિતિની કચેરીમાં રજૂ કરવાના રહેશે.

(૭) ઉક્ત જગ્યા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે જ અરજી કરવાની રહેશે, તેમજ ઓનલાઇન અરજીમાં પસંદગીના જગ્યાઓ દર્શાવવા માટે જે તે જગ્યા સામેની ખાલી જગ્યામાં જગ્યાનો પસંદગીનો ક્રમ અચૂક દર્શાવવાના રહેશે. સામાન્ય રીતે ઉમેદવારોએ તમામ જગ્યા સામે પસંદગીના યોગ્ય ક્રમ દર્શાવવા, પરંતુ જો ઉમેદવારને મેરીટ આધારે પસંદગી ક્રમ આપેલ હોય તેવી જગ્યાઓ

પૈકીની કોઇ જગ્યામાં નિમણુંક મળે તેમ ન હોય ત્યારે સમિતિ ધ્વારા જાહેરાતમાં દર્શાવેલ બાકી રહેતી જગ્યાઓ પૈકીની કોઇપણ એક જગ્યામાં નિમણુંક આપવામાં આવશે જે ઉમેદવારને બંધનકર્તા રહેશે. ઉમેદવારે અરજીપત્રકમાં જગ્યા માટે આપેલ પસંદગી ક્રમોમાં કોઇપણ સંજોગોમાં પાછળથી સુધારા/વધારા કે ફેરફાર કરવા દેવામાં આવશે નહીં. (૮) સમિતિ તરફથી આપવામાં આવતી નવી સૂચનાઓ જોવા માટે જાહેરાતમાં દર્શાવેલ વેબસાઇટ અવારનવાર જોતાં રહેવું.

નોંધ:- (૧) જુનીયર ક્લાર્કની જગ્યાના ભરતી નિયમો અન્વયે ઠરાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ, પરીક્ષા ફી, પગાર ધોરણ તેમજ જાહેરાતની અન્ય તમામ વિગતો સમિતિની કચેરીના નોટીસ બોર્ડ ઉપર તેમજ (અ) NIC ની વેબસાઇટ <http://ojas.guj.nic.in> ઉપર (બ) “ગુજરાત રોજગાર સમાચાર” તથા તેની વેબસાઇટ [www.gujaratinformation.net](http://www.gujaratinformation.net) ઉપર તેમજ (ક) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરની વેબસાઇટ <http://panchayat.gujarat.gov.in> ઉપર પણ જોવા મળશે. (૨) ઉક્ત જાહેરાતની વિગતો તેમજ ઓનલાઇન અરજી ભરવા સંબંધિત કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે ચાલુ કામકાજના દિવસે કચેરી સમય દરમિયાન સમિતિની કચેરીનો ફોન નં. ૦૨૬૨૬-૨૨૧૮૦૯ ઉપર સંપર્ક કરી શકાશે.

૧૧. સામાન્ય સૂચનાઓ:-

(૧) સમિતિ જે કોઇ ઉમેદવારને (૧) તેને ઉમેદવારી માટે કોઇપણ પ્રકારે ટેકો મેળવવા માટે એટલે કે સમિતિના અધ્યક્ષ, સભ્ય અથવા કોઇ અધિકારી પર પ્રત્યક્ષ કે પરોક્ષ લાગવગ લગાડવાનો પ્રયાસ કરવા માટે (૨) બીજાનું નામ ધારણ કરવા માટે (૩) બીજા પાસે પોતાનું નામ ધારણ કરાવવા માટે (૪) બનાવટી, ખોટા દસ્તાવેજો અથવા જેની સાથે ચેડાં કરવામાં આવ્યા હોય તેવા દસ્તાવેજો સાદર કરવા અથવા ગેરરીતિ આચરવા માટે (૫) વ્યર્થ અથવા ખોટા અથવા મહત્વની માહિતી છૂપાવતા હોય તેવા નિવેદનો કરવા માટે (૬) પરીક્ષા માટે તેની ઉમેદવારીના સંબંધમાં અન્ય કોઇ અનિયમિત અથવા અયોગ્ય સાધનોનો આશ્રય લેવા માટે (૭) પરીક્ષા દરમિયાન ગેરવ્યાજબી સાધનોનો ઉપયોગ કરવા માટે એટલે કે, અન્ય ઉમેદવારની ઉત્તરવહીમાંથી નકલ કરવા, પુસ્તક, ગાઇડ, કાપલી કે તેવા કોઇપણ છાપેલા કે હસ્તલિખિત સાહિત્યની મદદથી અથવા વાતચીત ધ્વારા નકલ કરવા કે ઉમેદવારને નકલ કરાવવાની ગેરરીતિઓ પૈકી કોઇપણ ગેરરીતિ આચરવા માટે (૮) લખાણોમાં અશ્લિલ ભાષા અથવા બીભત્સ બાબત સહિતની અપ્રસ્તુત બાબત લખવા માટે (૯) પરીક્ષા ખંડમાં અન્ય કોઇ રીતે ગેરવર્તણુંક કરવા માટે (૧૦) પરીક્ષાના સંચાલન કરવા માટે સમિતિએ રોકેલા સ્ટાફની સીધી કે આડકતરી રીતે હેરાન કરવા અથવા શારીરિક રીતે ઇજા કરવા માટે (૧૧) પૂર્વવર્તી ખંડોમાં નિર્દિષ્ટ કરેલ તમામ અથવા કોઇપણ કૃત્ય કરવાનો પ્રયત્ન કરવા માટે અથવા યથા પ્રસંગ મદદગીરી કરવા માટે, અથવા (૧૨) પરીક્ષા આપવા માટે તેને પરવાનગી આપતા તેના પ્રવેશપત્રમાં આપવામાં આવેલી કોઇપણ સૂચનાનો ભંગ કરવા માટે દોષિત ઠર્યા હોય તો અથવા દોષિત હોવાનું જાહેર કર્યું હોય તો તે ફોજદારી કાર્યવાહીને પાત્ર થવા ઉપરાંત (ક) સમિતિ તે જે પરીક્ષાનો ઉમેદવાર હોય તે પરીક્ષામાંથી ગેરલાયક ઠરાવી શકશે અથવા (ખ) (૧) સમિતિ ધ્વારા સીધી ભરતીથી પસંદગી કરવાની કોઇપણ પરીક્ષામાં બેસવામાંથી અથવા (૨) રાજ્ય સરકાર પોતાના હેઠળની કોઇપણ નોકરીમાંથી કાયમી રીતે અથવા નિર્દિષ્ટ મુદત માટે બાકાત કરી શકશે.



- (૨) ઉમેદવારે અરજીપત્રકમાં બતાવેલી કોઇપણ વિગત અને ઉમેદવારે સમિતિ સમક્ષ રજૂ કરેલ જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અન્ય લાયકાતોને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે નિમણુંક અધિકારી ધ્વારા ચકાસણી દરમ્યાન ખોટા માલૂમ પડશે તો તેની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારની ઉમેદવારી સમિતિ ધ્વારા “રદ” કરવામાં આવશે. તેમજ ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવશે તેમજ આવા ઉમેદવારની જો પસંદગી/ નિમણુંક થયેલ હશે તો પસંદગી/ નિમણુંક સમિતિ ધ્વારા કોઇપણ તબક્કે “રદ” કરવામાં આવશે.
- (૩) સમિતિ ધ્વારા લેવાનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણુંક માટેનો હકક મળી જતો નથી. નિમણુંક સમયે સક્ષમ સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને નિમણુંક આપવામાં આવશે.
- (૪) પસંદગી પામેલ ઉમેદવારે નિમણુંક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધીન નિમણુંક મેળવવાને પાત્ર થશે.
- (૫) ઉમેદવાર પોતે પરીક્ષામાં સફળ થયો હોવાના કારણે જ સંબંધિત જગ્યા ઉપર નિમણુંક કરવાનો દાવો કરવાને હકકદાર થશે નહીં. નિમણુંક કરનાર સત્તાધિકારીને પોતાને એવી ખાતરી થાય કે, જાહેર સેવા સાદું તે યોગ્ય જણાતો નથી તો તેને પડતો મૂકી શકાશે. નિમણુંક બાબતે તેઓનો નિર્ણય આખરી ગણાશે.
- (૬) ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૯૮ અને તે અન્વયે જે તે સંવર્ગના ઘડવામાં આવેલ ભરતી નિયમોને આધિન રહેશે.
૧૨. આ જગ્યાની ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઇપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સમિતિને સંપૂર્ણ હકક/ અધિકાર રહેશે અને સમિતિ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં.

તારીખ:-૧૪-૧૨-૨૦૧૨

સ્થળ:- વ્યારા

સચિવ,

તાપી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ,

વ્યારા.

---

તાપી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ,  
વ્યારા.

૧. જાહેરાત ક્રમાંક: TDPSSC/ 01 /2012-13  
૨. અરજી કરેલ જગ્યાનું નામ: JUNIOR CLERK  
૩. અરજી ક્રમાંક: DPSSC/ 01/ 2012-13  
૪. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: ૩૧-૧૨-૨૦૧૨

પાસપોર્ટ  
સાઇઝનો  
ફોટોગ્રાફ  
(૧૫ kb)

ઉમેદવારની માહિતી

ઉમેદવારની સહી

ઉમેદવારનું નામ:

માતાનું નામ:

હાલનું સરનામું:

જીલ્લો:

રાજ્ય:

જન્મ તારીખ:

Category-Caste

Non-Creamy Layer Certificate No:

Physical disabled:

Apply as General Candidate:

Name of recognized Sports:

કાયમી સરનામું:

જીલ્લો:

નાગરિકત્વ:

Gender:

Marital Status:

Basic Computer Knowledge or any other equivalent exam. passed:

Non-Creamy Layer Certificate Date:

Widow:

Mobile No:

Email:

Sports Detail: (A) state /National /Vocational

(B) Rank (1<sup>st</sup>, 2<sup>nd</sup>, 3<sup>rd</sup>)  
(D) Certificate issued

(c) Winner Team  
by.....

Ex-service man:-

If Yes, Period of service as Ex-serviceman:

Year

Month

Ex-Servicemen Identity Card No

Issued by Jilla Sainik Board .....

જાણતા હોય તે ભાષાઓ	હિન્દી	ગુજરાતી
બોલી શકો/વાંચી શકો/લખી શકો	હા/ હા/ હા/	હા/ હા/ હા/

શૈક્ષણિક લાયકાત

પાસ કરેલ પરીક્ષા	મેળવેલ ગુણના ટકા	કલાસ	પાસ કર્યાનું વર્ષ	બોર્ડ/યુનિવર્સિટીનું નામ
પાસ કરેલ પરીક્ષાની વિગત				

Preference for appointment :

૧. જુનીયર કલાર્ક (વહીવટ)	૨. જુનીયર કલાર્ક (હિસાબી)
--------------------------	---------------------------

બાંહેધરી:

હું, .....આથી ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જો તેમાં કોઈ પણ વિગતો ખોટી હશે તો તે અંગે બોર્ડ/ સક્ષમ નિમણુંક સત્તાધિકારીનો નિર્ણય અંતિમ રહેશે અને તે મને બંધનકર્તા છે. આ જાહેરાતમાં દર્શાવેલ તમામ નિયમો, શરતો અને આ જગ્યાના ભરતી નિયમો મને કબૂલ છે.

તારીખ:

ઉમેદવારની સહી:

(૧૦ kb)

તાપી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, વ્યારા, જાહેરાત ક્રમાંક: ૦૧/૨૦૧૨-૧૩, અન્વયે  
જુનીયર ક્લાર્કની જગા માટેનું ચેકલીસ્ટ.

આ જગા માટેની વયમર્યાદા તા.૩૧-૧૨-૨૦૧૨ ની સ્થિતિએ:-

૧૮ વર્ષથી ઓછી નહીં અને ૨૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ

ક્રમ	ઉમેદવારની જાતિ	નીચેની તારીખો દરમિયાન (બન્ને તારીખો સહીત) જન્મેલા હોવા જોઈએ.
૧.	સામાન્ય કેટેગરી (પુરુષ ઉમેદવાર)	તા.૧/૧/૧૯૮૮ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૨.	એસ.સી./એસ.ટી./એસ.ઇ.બી.સી. (પુરુષ ઉમેદવારો) (૫ વર્ષ)	તા. ૧/૧/૧૯૮૩ થી તા. તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૩.	મહિલાઓ (સામાન્ય કેટેગરી) (૫ વર્ષ)	તા. ૧/૧/૧૯૮૩ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૪.	અનામત વર્ગની મહિલાઓ (૫+૫ વર્ષ)	તા.૧/૧/૧૯૭૮ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૫.	૪૦% કે તેથી વધુ અશક્તતા ધરાવતા સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો (૧૦ વર્ષ)	તા.૧/૧/૧૯૭૮ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૬.	૪૦% કે તેથી વધુ અશક્તતા ધરાવતા અનામત વર્ગના પુરુષ ઉમેદવારો (૫+૧૦ વર્ષ)	તા.૧/૧/૧૯૭૩ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૭.	૪૦% કે તેથી વધુ અશક્તતા ધરાવતી સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો(૫+૧૦ વર્ષ)	તા.૧/૧/૧૯૭૩ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત)
૮.	૪૦% કે તેથી વધુ અશક્તતા ધરાવતી અનામત વર્ગની મહિલાઓ	તા.૧/૧/૧૯૭૩ થી તા.૩૧/૧૨/૧૯૯૪ (બન્ને તારીખો સહીત) (મહત્તમ -૪૫ વર્ષની ઉંમરની મર્યાદામાં)
૯.	માજી સૈનિક:- સામાન્ય વહીવટ વિભાગનો તા. ૨૨-૭-૧૯૮૨ના ઠરાવ ક્રમાંક: આરઇએસ-૧૦૮૧/જીઓઆઇ/૫૮/ગ-૨, અને તા.૨૦-૨-૨૦૦૧નો ઠરાવ ક્રમાંક: આરઇએસ/૧૦૨૦૦૦/યુ.ઓ./૯૫૭/ગ-૨.	આ સંવર્ગની ખાલી જગ્યા ઉપર નિમણુંક માટે જે ઉમેદવારે માજી સૈનિક તરીકે સશસ્ત્ર દળોમાં છ મહિનાની સળંગ સેવા કરતાઓછી ન હોય તેટલી સેવા કરી હોય તે માજી સૈનિકને મળવાપાત્ર ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ(૩) વર્ષ સુધીની છુટછાટ મળશે.
૧૦.	મહત્તમ ઉપલી વયમર્યાદા	તા.૧/૧/૧૯૮૮ ના રોજ કે તે પછી જન્મેલ હોવા જોઈશે.
૧૧.	લઘુત્તમ વયમર્યાદા	તા.૩૧/૧૨/૧૯૯૪ના રોજ કે તે પહેલા જન્મેલ હોવા જોઈશે.
૧૨.	શૈક્ષણિક લાયકાત:- જુનીયર ક્લાર્ક	(ક) તા. ૩૧-૧૨-૨૦૧૨ના રોજ ઉમેદવાર ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો ન હોવો જોઈએ અને ૨૫ વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ નહીં. (ખ) ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા

		<p>(ઘોરણ-૧૨ H.S.C.E.) અથવા સરકારે માન્ય કરેલ સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે.</p> <p>(ગ) ઉમેદવાર ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.</p> <p>નોંધ- જુનીયર કલાર્ક(હિસાબી)ની જગ્યા માટે ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા (ઘોરણ-૧૨ H.S.C.E.) ગણિતશાસ્ત્રના એક વિષય સાથે પાસ કરેલી હોવી જોઈશે.</p>
૧૩.	<p>પરીક્ષા ફી:-</p> <p>(૧) ફક્ત બિન અનામત વર્ગ (સામાન્ય) કેટેગરીના ઉમેદવારો માટે</p>	<p>(૧) ફોર્મ ભરતી વખતે “ બિન અનામત” કેટેગરી સીલેક્ટ કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા Ex.Servicemen કેટેગરી સિવાય) તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ફરવાની રહેશે.</p> <p>(૨) બિન અનામત વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે.</p> <p>બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારોએ પરીક્ષા સમયે પરીક્ષા ફી પેટે રૂ. ૧૦૦/- નો ભારતીય પોસ્ટલ ઓર્ડર સ્પર્ધાત્મક લેખિત કસોટીની તારીખ આખરી જાહેર થયા બાદ કોલલેટર online મેળવીને તુરત ખરીદેલ અને સચિવશ્રી, તાપી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, વ્યારાના નામનો ક્રોસ ભારતીય પોસ્ટલ ઓર્ડર પરીક્ષા દિને કોલલેટરની સાથે લાવવાનો રહેશે અને પરીક્ષા હોલમાં ઇન્વીજીલેટરને સોંપવાનો રહેશે. (ફી રોકડમાં કે ડીમાન્ડ ડ્રાફ્ટમાં સ્વીકારવામાં આવશે નહીં) પરીક્ષા ફી અંગે ભારતીય પોસ્ટલ ઓર્ડર વગર આવેલ બિન અનામત વર્ગના ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.</p> <p>(૩) મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો, શારીરિક ખોડખાંપણ ધરાવતા ઉમેદવારો અને માજી સૈનિકોએ પરીક્ષા ફી ભરવાની નથી.</p> <p>(૪) અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત વર્ગની જગ્યા માટે અરજી કરે તો પણ તેઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.</p>
	<p>(૨) અનામત વર્ગ માટે, માજી સૈનિક, ૪૦% કે તેથી વધુ અશક્તતા ધરાવતા ઉમેદવાર માટે</p>	<p>વિના મૂલ્યે</p>